

ક્રમાંક:પ્રાશિનિ/છ-૨/સંકલન/૨૦૧૯/૬૮૨૫-૬૯૦૨
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
બ્લોક નં-૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન,
ગુ. રા. ગાંધીનગર, તા. ૦૯/૧૨/૨૦૧૯

પ્રતિ,


- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ
- શાસનાધિકારીશ્રી, તમામ

વિષય:- રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસ મંજૂરી બાબત.

સંદર્ભ:- શિક્ષણ વિભાગનો પરિપત્ર ક્રમાંક:- ૫૨૫-૧૨૨૦૧૯-૯૯-વ-૨ તા. ૦૫/૦૨/૨૦૧૯

ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસ અંગેની મંજૂરી અત્રેની કચેરી દ્વારા મેળવવાની રહે છે. આ માટે આપની કક્ષાએથી પ્રવાસ મંજૂરી અંગેની ફાઇલની યોગ્ય ચકાસણી કરી અત્રેની કચેરીમાં રજૂ કરવાની રહેશે. આ સાથે સામેલ ચેકલીસ્ટના ચેક પોઈન્ટ મુજબ વિગતો ચકાસીને ચેકલીસ્ટમાં માહિતી આપવી. મંજૂરી માટે દરખાસ્ત ૧૫ દિવસ અગાઉ અત્રેની કચેરીને મોકલી આપવાની રહેશે.

અત્રેની કચેરીમાં આવતી દરખાસ્તોને ધ્યાને લેતા જણાય છે કે, આ બાબતે શાળા અને શિક્ષકો અજાણ છે. આથી આ સાથે સામેલ પ્રવાસ અંગેનો પરિપત્ર આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક સરકારી અને ખાનગી શાળાઓ સુધી મોકલી આપવા આથી જણાવવામાં આવે છે.



નાયબ શિક્ષણ નિયામક વતી
પ્રાથમિક શિક્ષણ
ગુ. રા. ગાંધીનગર

વિનિમ્ન

પરિ. નં. ૩૫૫

ક્રમાંક:પરીક્ષા /પ્રવાસ/૧૯-૨૦
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,
અમરેલી તા.૧૬/૧૨/૨૦૧૯

ઉપરોક્ત પરીપત્રની જાણ તથા અમલ કરવા સારું.


જિલ્લા શિક્ષણાધિકારી
અમરેલી વતી

પ્રતિ,

આચાર્યશ્રી,

સરકારી/ગ્રાન્ટેડ/નોન- ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.મા શાળાઓ તમામ
જિ-અમરેલી


રાજ્ય બહાર શાળા પ્રવાસની મંજૂરી અંગેનું ચેકલીસ્ટ

ક્રમ	ચેક પોઈન્ટ	વિગત
૧	શાળાનું નામ	
૨	તાલુકો /જિલ્લો	
૩	પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ/શિક્ષકોની સંખ્યા	
૪	પ્રવાસ આયોજન સમયપત્રક સામેલ છે ?	
૫	એસએમસી ઠરાવ કરેલ છે ?	
૬	તમામ વાલીના સંમતીપત્રક મેળવેલ છે ?	
૭	વાહનનો પ્રકાર (સરકારી બસ,રેલવે,વિમાન,ખાનગી)	
૮	ટ્રાવેલ્સ (ખાનગી) હોય તો આરટીઓ માન્યતા પત્ર અને ડ્રાઈવર લાયસન્સ સામેલ છે ?	
૯	પ્રવાસમાં શિક્ષક/વિદ્યાર્થી સંખ્યા રેશીઓ મુજબ છે ?	
૧૦	પ્રવાસમાં જનાર શિક્ષક/વિદ્યાર્થીની યાદી સામેલ છે ?	
૧૧	પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓના ઓળખ કાર્ડ મેળવેલ છે ?	
૧૨	તમામ વાલીના સંપર્ક નંબર મેળવેલ છે ?	
૧૩	સ્થાનિક પોલીસને જાણ કરેલ છે ?	
૧૪	પ્રવાસના વાહનમાં આરટીઓની મંજૂરી મુજબની જ સંખ્યા છે ?	
૧૫	તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો અભિપ્રાય	

આથી ઉપરોક્ત પ્રવાસ બાબતે પ્રમાણપત્ર આપમાં આવે છે કે, પ્રવાસ મંજૂરી અંગેની દરખાસ્તમાં ઉપરોક્ત જરૂરી આધારો સામેલ છે. જે ખરાઈ કરવામાં આવેલ છે. આથી પ્રવાસની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવે છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

2019/12/15



શાળાઓ તથા કોલેજોના શિક્ષકો
પ્રવાસના આયોજનમાં અનિચ્છનીય
બનાવો નિવારવા બાબત.

પરિપત્ર:-

શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓનાં વ્યક્તિત્વ ઘડતર, અવલોકન શક્તિ, નવું જાણવાની જીભાસાના સંતોષ માટે તથા વિદ્યાર્થીઓ આનંદ સાથે અભ્યાસનો હેતુ શિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક, વિકસિત સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, જે દરમિયાન પ્રવાસનો મૂળ હેતુ ફલિતાર્થ થાય તથા કોઇ આગ, અકસ્માત સહિત અનિચ્છનિય ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તે માટે નીચેની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

(૧) શાળા, કોલેજોના અભ્યાસને વિક્ષેપ ન પહોંચે તે મુજબ આયોજન કરવું

(૨) શાળા/કોલેજોના પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્ય/કોલેજના પ્રિન્સીપાલની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવી તથા કમિટી દ્વારા પ્રવાસ માટેના સ્થળની પસંદગી કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, પ્રવાસના લાલ-ગેરલાલ જોખમો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી સ્થળોની પસંદગી કરવી એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના કન્વીનર તરીકે નિમણૂક કરવી તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવું.

(૩) શક્ય હોય ત્યાં સુધી સુર્યાસ્ત બાદ અર્થાત રાત્રી મુસાફરી ન કરવી તથા તે મુજબનું જ આયોજન કરવું, પ્રવાસના કી.મીની અને દિવસોની મર્યાદા નક્કી કરવી.

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો ૭.૦૦ (૧૯.૦૦) કલાક, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ૮.૦૦ (૨૦.૦૦) કલાક સુધીમાં તથા કોલેજના વિદ્યાર્થીઓ હોય તો ૧૦.૦૦ (૨૨.૦૦) કલાક સુધીમાં રોકાણના સ્થળે મોડામોડા પહોંચી જવું.

(૪) વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાને લઈ તે મુજબ પ્રવાસનું આયોજન કરવું. પ્રવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહનનો RTO દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ RC બુક, ડ્રાઇવરનું લાયસન્સ, વીમો વગેરેની નકલો પૂર્વેથી મેળવવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી.

(૫) વાહનમાં ફાયર સેફ્ટીના સાધન, ફર્સ્ટ એઇડ કીટ પુરતા પ્રમાણમાં હોવી જરૂરી છે તથા તેના ઉપયોગની પુરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવી.

(૬) જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓની મીટીંગ કરવી, તેમને આયોજનથી અવગત કરાવવા તથા તેમની સંમતિ મેળવવી. જો વાલી કોઇ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિત લેવી, સાથે વિદ્યાર્થીઓના મા-પિતા/વાલીના આઇ.ડી પુક તથા મોબાઇલ નંબર મેળવવા તથા સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.

(૭) પ્રવાસ મરજીયાત રહેશે કોઇપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ ન પાડવી.

(૯) વાહનમાં GAS ટ્રેકિંગ સીસ્ટમ હોય તેવાં વાહન પસંદ કરવાં તથા બસ ડ્રાઇવર તથા બસના સ્ટાફ કેસી પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાત્રી કરવી, જો દેખિતી રીતે ડ્રાઇવર વાહન બરાબર ચલાવતો ન હોય તો આગળ મુસાફરી ન કરવી. પ્રવાસના વાહનમાં આર.ટી.ઓના પરમીટ મુજબની જ સંખ્યા પ્રમાણે પ્રવાસનુ આયોજન કરવું. કોઇપણ સંજોગોમાં મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત કરવું.

(૯) વિદ્યાર્થીઓનો રાત્રી રોકાણ માટે આરોગ્યપ્રદ, સ્વચ્છ અને સલામત સ્થાનની પસંદગી કરવી તથા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવી. જેથી કોઇ આકસ્મિક ઘટના નિવારી શકાય.

(૧૦) વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મીટીંગ કરી, "શું કરવું, શું ન કરવું" તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર દેખરેખની વ્યવસ્થા કરવી, ટ્રેકમાં સલામતિ નો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.

(૧૧) પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતિ જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી યોગ્ય આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની સંપૂર્ણ તકેદારી રાખવી.

(૧૨) નાણાકીય હિસાબ સ્પષ્ટ પારદર્શક રાખવા તથા વિદ્યાર્થીઓ અને તેના વાલીને અવગત કરવા.

(૧૩) પ્રવાસ કરવામાં આવે ત્યારે તેની આયોજનની વિગતો પ્રાથમિક શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, માધ્યમિક શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને કોલેજોએ સંબંધિત યુનિવર્સિટીને જાણ કરવી.

(૧૪) સરકારી શાળા/કોલેજો, અનુદાનીત શાળા/કોલેજો, ખાનગી શાળા/કોલેજો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ માટે રાજ્યની અંદર પ્રવાસ માટે

ક્રમ	હોદ્દો	ક્ષેત્ર
૧	જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી	તાબાની હોય તે તમામ પ્રાથમિક શાળાઓ,
૨	જિલ્લા શિક્ષણાધિકારી	તાબાની હોય તે તમામ માધ્યમિક શાળાઓ, તમામ પીટીસી કોલેજો,
૩	પ્રિન્સીપાલ ડાયટ	તાબાની તમામ કોલેજો, પી.ટી.સી. કોલેજો
૪	કોલેજના પ્રિન્સીપાલ	તાબાની તમામ કોલેજો તથા તાબા હેઠળની શૈક્ષણિક સંસ્થાઓ.

(૧૫) સરકારી શાળા/કોલેજો, અનુદાનીત શાળા/કોલેજો; ખાનગી શાળા/કોલેજો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ માટે, રાજ્ય બહારના પ્રવાસ માટે,

ક્રમ	કચેરીનું નામ
૧	નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ કચેરી
૨	નિયામકશ્રી શાળાઓની કચેરી
૩	નિયામકશ્રી ગુજરાત શૈક્ષણિક અને સંસોધન તાલીમ પરિષદ
૪	નિયામક શ્રી સમગ્ર શિક્ષા અભિયાન
૫	જે તે યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી

વગેરે રાજ્ય કક્ષાની કચેરીઓ મંજૂરી આપશે.

(૧૬) શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી તેવી શિક્ષણિક સંસ્થાઓ, ખાનગી એકમો(સંસ્થાઓ) હોય તેને શિક્ષણ વિભાગની મંજૂરીનો પ્રશ્ન રહેશે નહીં તેઓ તેમની જવાબદારીએ પ્રવાસ કરતા હોય છે, અને તે તેમની જવાબદારી રહેશે.

(૧૭) દેખિતા જ લાગે તેવા બિમાર વિદ્યાર્થીઓ, પ્રવાસ સહન ન કરી શકે તેવા, નબળા વિદ્યાર્થીઓ તથા પ્રવાસથી ચેલર્જી હોય તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહીં.

(૧૮) પ્રવાસ દરમિયાન રાજ્યમાં કે રાજ્ય બહાર આલ્કોહોલ, કેફી પ્રવાહી કે પદાર્થો લેવામાં ન આવે તેની સંપૂર્ણ ખાતરી કરી લેવાની તથા પ્રવાસ દરમિયાન કાળજી રાખવાની રહેશે.


(૧૯) જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે.

(૨૦) બસમાં મુસાફરી કરનાર તમામ જેમાં ડાઇવર તથા તેના સહાયક સ્ટાફ, શાળા/કોલેજ સ્ટાફ વિદ્યાર્થીઓ વગેરેના જરૂરી માહિતીની સાથેના ઓળખકાર્ડ બિનચૂક લેવા જોઈએ.

(૨૧) પ્રવાસના આયોજનની જાણ સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશને કરવી.

(૨૨) ઉપર્યુક્ત સૂચના સરકારી, અનુદાનિત તથા ખાનગી તમામ પ્રકારની શાળા, કોલેજને લાગુ પડશે. જેથી ઉક્ત તમામ સૂચનાઓના અચૂક અમલ કરવાનો રહેશે.

આ પરિપત્ર સરકારશ્રીની તા.૨૮/૨/૨૦૧૯ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.


(બી.વી.રાઠવા)
ઉપ સચિવ
શિક્ષણ વિભાગ

પ્રતિ,

- (૧) કમિશ્નરશ્રી, શાળાઓની કચેરી, બ્લોક નં ૯, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
 - (૨) કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણની કચેરી, બ્લોક નં ૧૨, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
 - (૩) કમિશ્નરશ્રી, ટેકનિકલ શિક્ષણની કચેરી, કર્મચોગી ભવન, ગાંધીનગર
 - (૪) નિયામકશ્રી, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
 - (૫) સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સમગ્ર શિક્ષા અભિયાન, સેક્ટર નં ૧૭, ગાંધીનગર
 - (૬) સચિવશ્રી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ સેક્ટર નં ૧૦બી ગાંધીનગર
 - (૭) સચિવશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-૨૧ ગાંધીનગર.
 - (૮) નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી, બ્લોક નં ૧૨, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
 - (૯) નિયામકશ્રી, ગુજરાત શિક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ સેક્ટર નં ૧૨ ગાંધીનગર
 - (૧૦) નિયામકશ્રી એન.સી.સી., અમદાવાદ
 - (૧૧) વિભાગની સર્વે શાખાઓ
 - (૧૨) સિલેક્ટ ક્ષણ.
- નકલ રવાના-
- અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- મુખ્ય સચિવશ્રી, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર

Scanned with CamScanner

Scanned by CamScanner

Scanned by CamScanner